



એકઝામ અને રજીસ્ટ્રેશન ને લગતા અમુક સવાલો.

વર્ષ દરમિયાન બે વાર એકઝામ લેવામાં આવે છે. -કયા કયા મહિના માં?
જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં.

એકઝામ કેટલી ટાઈપ ની છે?

એકઝામ બે ટાઈપ છે. ઓનલાઈન અને ઓફલાઈન

રજીસ્ટ્રેશન કોણે કરવાનું હોય ?

Online exam આપો કે off-line exam આપો, રજીસ્ટ્રેશન દરેક એકઝામ માટે ફરજિયાત છે. દરેક સ્ટુડન્ટ ને એક રજીસ્ટ્રેશન વખતે એક ID નંબર આવે છે, એજ ID નંબર આપ નો કાયમી રોલ નંબર રહેશે. એજ રોલ નંબર દરેક વખતે રજીસ્ટ્રેશન વખતે લખવાનો.

દરેક વખતે નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર છે ?

ના (એક જ રોલ નંબર આપનો 24 શ્રેણી સુધી રહશે.)

(આપનો આધાર નંબર હોય, એવી રીતે એક જ રોલ નંબર આપ ધાર્મિક શિક્ષણ બોર્ડ નો આપનો ID કે રોલ નંબર રહશે.)

નવું રજીસ્ટ્રેશન કોણે કરવું ?

ફક્ત ને ફક્ત પહેલી શ્રેણી ની એકઝામ આપનાર સ્ટુડન્ટ એ જ નવું રજીસ્ટ્રેશન કરવું.

સ્ટુડન્ટ દહિસર રહેતો હોય , ને પછી બોરીવલી રહેવા માટે આવે તો, તેણે નવું રજીસ્ટ્રેશન કરવાનું ?

ના (એણે હેલ્થ લાઈન નંબર પર મેસેજ કરી દેવાનો કે મારું મંડળ ને સંઘ યેન્જ કરી આપો) એના માટે નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.

આપનો રોલ નંબર આપ કેવી રીતે મેળવી શકશો?

આપ અમારા હેલ્થ લાઈન નંબર પર વોટ્સ પર મેસેજ કરી, આપનો રોલ નંબર મેળવી શકશો.

ઓનલાઈન એકઝામ લગતા સવાલો

ઓનલાઈન એકઝામ એટલે શું?

ઓનલાઈન એકઝામ ઘરે થી મોબાઈલ પર કે લેપ ટોપ પર આપવાની છે. એમાં MCQ ટાઈપ સવાલ જવાબ આવે. (કોન બનેગા કરોડપતિ માં જેવી રીતે સવાલો આવે એવી રીતે સવાલો દેખાશે) આપને સાચા સવાલ પર ટિક કરવાનું રહેશે.

ઓનલાઈન એકઝામ માં કેટલા સવાલો હશે ? અને શું સમય હશે ?

આ એકઝામ માં 50 સવાલો રહેશે. એક પછી એક સવાલો આપની સ્ક્રીન પર દેખાશે. આપે એ સવાલ ના જવાબ પોણો કલાક માં આપવાના રહેશે.

(50 questions 45 minutes timing).

ઓનલાઈન એકઝામ કેવી રીતે આપવાની ?

Online exam માટે એક લિંક ટેલીગ્રામ ગ્રુપ માં આવશે. એ લિંક પર ક્લિક કરી, ત્યાં રોલ નંબર લખશો એટલે એકઝામ પેપર ખુલી જશે. (ટેલીગ્રામ ગ્રુપ માં જોડાવા માટે નીચે લીંક આપી છે)

ઓનલાઇન એકઝામ કઈ ભાષા માં હશે ?

ઓનલાઇન એકઝામ ગુજરાતી ભાષા તેમજ લિપિ ઇંગ્લિશ ને ભાષા ગુજરાતી એ બન્ને માં રહેશે.

ઓનલાઇન એકઝામ કેટલી શ્રેણી સુધી છે ?

શ્રેણી 8 સુધી.

ઓનલાઇન એકઝામ કોણ કોણ આપી શકે?

ઓનલાઇન એકઝામ મહિલા મંડળ, યુવક મંડળ અને જૈન શાળા નાં બાળકો બધા આપી શકે.

ઓફલાઇન એકઝામ લગતા સવાલો

ઓફલાઇન એકઝામ એટલે શું ?

ઓફ લાઇન એકઝામ બે ટાઇપ ની રાખવામાં આવેલ છે.

૧) રેગ્યુલર એકઝામ

રેગ્યુલર એકઝામ આપણે જે વર્ષો થી આપતા આવ્યા છે, એજ રીતે આપવાની રહેશે.

૨) ઓપન બુક એકઝામ

આ વર્ષે જુલાઈ 2022 માં આપણે પહેલી વાર નવી એકઝામ ટાઇપ ની શરૂવાત કરી. જેમાં આપણે આપની શ્રેણી ની બુક ખુલ્લી રાખી એકઝામ આપવાની રહેશે.

બંને એકઝામ ઉપાશ્રય માં જઈ ને આપવાની રહેશે ?

હા, ઉપાશ્રય માં બંને ટાઇપ ની પરીક્ષા ના વિદ્યાર્થીઓ ને અલગ અલગ બેસવા ની સગવડતા રાખેલ છે.

બંને એકઝામ માં એકઝામ પેપર અલગ હશે ?

નાં - એક જ સરખા રહેશે.

ઓપન બુક કઈ કઈ બુક ખુલ્લી રાખી એકઝામ આપવાની ?

શ્રેણી ની ચોપડી , પ્રતિક્રમણ અને સામાયિક ની બુક ખુલ્લી રાખી પેપર લખવા નું રહેશે.

હાથે થી લખેલ કોઈ બુક સાથે રાખી એકઝામ લખી શકાય ?

ના

રેગ્યુલર એકઝામ કોણ આપી શકે ?

રેગ્યુલર એકઝામ મહિલા મંડળ, યુવક મંડળ તેમજ જૈન શાળા ના બાળકો બધા જ આપી શકે.

રેગ્યુલર એકઝામ માં મંડળ ને જૈન શાળા ના પેપર અલગ હશે ?

હા

રેગ્યુલર એકઝામ મહિલા મંડળ અને યુવક મંડળ માટે કઈ કઈ ભાષા માં છે ?

1 થી 24 શ્રેણી ગુજરાતી

1 થી 4 શ્રેણી હિંદીમાં

રેગ્યુલર એકઝામ જૈનશાળા માટે કઈ કઈ ભાષા માં છે ?

1 થી 8 શ્રેણી ગુજરાતીમાં

1 થી 4 શ્રેણી હિંદીમાં

1 થી 4 શ્રેણી ઇંગ્લિશમાં

રેગ્યુલર એકઝામ માં જૈનશાળા નાં બાળકો એ એક થી ચાર શ્રેણી ના પેપર માં જ જવાબ લખવા નાં રહશે ?

હા

રાઈટર ની મદદ થી પેપર લખશે તેને રેન્ક મળે ?

ના

રેગ્યુલર એકઝામ નું રિઝલ્ટ ક્યારે આવે ?

રિઝલ્ટ ત્રણ મહિના પછી આવે.

Contact Us

હેલ્પ લાઈન નંબર

wa.me/919702277914

OR

wa.me/919323346643

Join on Telegram

<https://t.me/+VNshhKLiUsUEOXrw>

Follow Our FB Page

<https://www.facebook.com/jaineducationboard>

Our Website

[https://www.jainshikshan.org/જય જિનેન્દ્ર - ૨૨૨](https://www.jainshikshan.org/)